

Extra No. 10



सत्यमेव जयते

The Gujarat Government Gazette

EXTRAORDINARY

PUBLISHED BY AUTHORITY

Vol. LXV]

THURSDAY, JANUARY 25, 2024 / MAGHA 5, 1945

Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.

PART IV-C

**Statutory Rules and Orders (Other than those published in Parts I, I-A and I-L)
made by Statutory Authorities other than the Government of Gujarat
including those made by the Government of India, the High Courts, the
Director of Municipalities, the Commissioner of Police, the Director of
Prohibition and Excise, the District Magistrates and the Election
Commission, Election Tribunals, Returning Officers and other
authorities under the Election Commission.**

ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગ
ગાંધીનગર, ૨૪મી જાન્યુઆરી, ૨૦૨૪
૨૦૨૪ ના જાહેરનામા ક્રમાંક : ૦૪

તારીખ: ૬ ડિસેમ્બર, ૨૦૨૩ ના ગુજરાત રાજપત્ર (અસાધારણ) માં અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલ સન ૨૦૨૩ ના જાહેરનામા ક્રમાંક ૫ નો ગુજરાતી અનુવાદ આથી સર્વે લોકોની જાણ સારુ પ્રસિદ્ધ કર્યો છે.

રણજીત કુમાર જે., આઈ.એ.એસ.
સચિવ.

ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગ (જીઈઆરસી) ગાંધીનગર

ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગ (પુરવઠો પૂરો પાડવા પેટે કરેલ ખર્ચ અને પ્રકીર્ણ ખર્ચ વસૂલ કરવા પરવાનેદારને સત્તા) (તૃતીય સુધારા)
વિનિયમો, ૨૦૨૩.

જાહેરનામું

ગુજરાત વિદ્યુત અધિનિયમ, ૨૦૦૩ (સન ૨૦૦૩ના ૩૬મા અધિનિયમ)ની કલમ ૪૫ અને ૪૬ સાથે વાંચતા, કલમ ૧૮૧ (૨) (ii) હેઠળ મળેલી અને આ અર્થે તેને સક્ષમ કરતી તમામ સત્તાની રૂએ, ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગ આથી, ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગ (પુરવઠો પૂરો પાડવા પેટે કરેલ ખર્ચ અને પ્રકીર્ણ ખર્ચ વસૂલ કરવા પરવાનેદારને સત્તા) વિનિયમો, ૨૦૦૫ (સન ૨૦૦૫ ના જાહેરનામા ક્રમાંક ૯) (મુખ્ય વિનિયમો)માં સુધારો કરે છે.

૧. ટૂંકુ શીર્ષક, વ્યાપ્તિનું ક્ષેત્ર અને આરંભ

- ૧.૧ આ વિનિયમો, ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગ (પુરવઠો પૂરો પાડવા પેટે કરેલ ખર્ચ અને પ્રકીર્ણ ખર્ચ વસૂલ કરવા પરવાનેદારને સત્તા (તૃતીય સુધારા) વિનિયમો, ૨૦૨૩ કહેવાશે.
- ૧.૨ આ વિનિયમો સમગ્ર ગુજરાત રાજ્યને લાગુ પડશે.
- ૧.૩ આ વિનિયમો સરકારી રાજપત્રમાં તેની જાહેરનામાની તારીખથી અમલમાં આવશે.

૨. મુખ્ય વિનિયમોના પ્રકરણ ૨-માં સુધારો.

૧. મુખ્ય વિનિયમોના ખંડ ૨.૧ (૧૭)ને, નીચે પ્રમાણે મૂકવો:

“કામચલાઉ સેવા” એટલે શરૂઆતમાં બાર મહિનાથી વધુ ન હોય તેવી મુદત માટે આપવામાં આવતો વીજળી પુરવઠો, જે કાયમી પુરવઠાના હેતુ માટે વીજ-ગોઠવણના વર્ગીકરણ અનુસાર વધુ મુદત લંબાવવા માટે સમીક્ષાને અધીન રહેશે.

૩. મુખ્ય વિનિયમોના પ્રકરણ ૭-માં સુધારો.

૧. મુખ્ય વિનિયમોના ખંડ ૭ (૬)ને, નીચે પ્રમાણે મૂકવો:

(૬) વધારાની રકમ, જો કોઈ હોય તો, જોડાણ સક્રિય થયાના ૩૦ દિવસની અંદર એકાઉન્ટ પેઈ ચેક કાઢી આપીને અથવા ઇલેક્ટ્રોનિક માધ્યમથી અરજદાર /ગ્રાહકને પરત કરવામાં આવશે, જેમાં નિષ્ફળ જવા પર પરવાનેદાર, આયોગ દ્વારા બહાર પાડેલા પ્રવર્તમાન પ્રશુલ્ક હુકમ અનુસાર વિલંબિત ચુકવણી ખર્ચના સમકક્ષ દરે, વ્યાજ ચૂકવવા માટે જવાબદાર રહેશે. અરજદાર/ગ્રાહકને શક્ય હોય તેટલા પ્રમાણમાં બાબતવાર તફાવતના આંકડાઓની સાથે બાબતવાર અંદાજ અને વાસ્તવિક ખર્ચની વિગતો દર્શાવતું વિગતવાર બિલ આપવામાં આવશે. વધુમાં, અરજદાર વધુ માહિતી માગે તો તેને વિતરણ પરવાનેદાર તે આવી વિનંતી મળ્યાના ૧૦ દિવસની અંદર રજૂ કરશે અથવા તે નહિ રજૂ કરવા અંગેના કારણો જણાવશે.

૨. મુખ્ય વિનિયમોના ખંડ ૭ (૭)ને, નીચે પ્રમાણે મૂકવો:

(૭) અરજદાર/ગ્રાહકે જમા કરાવેલી રકમ કરતાં વધુનો કોઈપણ ખર્ચ, અરજદાર/ગ્રાહક દ્વારા માગણીના ત્રીસ દિવસમાં ચૂકવવામાં આવશે, જો તેમ ન થાય તો આવી રકમ ગ્રાહકના આગામી વીજ બિલમાં ઉધારવામાં આવશે.

૪. મુખ્ય વિનિયમોના પ્રકરણ ૮-માં સુધારો.

૧. મુખ્ય વિનિયમોના ખંડ ૮ (૨)ને, નીચે પ્રમાણે મૂકવો:

[ખંડ ૮.૨ (ચ) (f)માં નિર્દિષ્ટ કરેલા ખર્ચ સિવાય] નીચે ૮.૧ અને ૮.૨ અન્વયે સૂચિત કરેલા તમામ ખર્ચ અગાઉથી ચૂકવવાપાત્ર છે.

ગાંધીનગર

તારીખ: ૦૫/૧૨/૨૦૨૩

રણજીથ કુમાર જે., આઈ.એ.એસ.

સચિવ.

